

ત્વરિત જાહેરાત માટે

## બ્રેમ્પટનમાં આ વર્ષે હેલોવીન સુરક્ષિત રીતે ઉજવો!

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 20, 2020) – આ વર્ષે, COVID-19 ને લીધે બ્રેમ્પટનમાં હેલોવીનની ઉજવણી જુદી જણાશે. રહેવાસીઓ ઘરે પોતાના સુશોભનો કરવાનું અને પોતાના સ્પૂક-ટેક્યુલર (આશ્ચર્યજનક રીતે ડરામણા) હેલોવીનનું આયોજન કરી રહ્યાં છે ત્યારે, સીટી ઓફ બ્રેમ્પટન રહેવાસીઓને આ વર્ષની ઉજવણીઓની સુરક્ષિત રીતે આનંદ માણવાની રીતો જણાવી રહ્યું છે.

### બ્રેમ્પટનમાં ટ્રિક ઓર ટ્રીટ (ઘરે-ઘરે જઈને "ટ્રિક ઓર ટ્રીટ" કહીને કેન્ડી માગવી)

પ્રોવિન્સ અને પીલ પબ્લિક હેલ્થના નિર્દેશોને અનુસરતા, પરંપરાગત ડોર-ટૂ-ડોર ટ્રિક ઓર ટ્રીટની ભલામણ સુધારેલા સ્ટેજ 2 પબ્લિક હેલ્થ યુનિટ રીજીયન્સમાં કરવામાં આવતી નથી, જેમાં પીલ રીજીયન અને બ્રેમ્પટન સામેલ છે, અને લોકોએ ઉજવણી કરવાની વૈકલ્પિક રીતો વિચારવી જોઈએ. આમાં નીચેની બાબતો સમાવી શકાય છે:

- બાળકોને વર્ચ્યુઅલ એક્ટિવિટીસ અને પાર્ટીઓ માટે તૈયાર થઈને સહભાગી થવા પ્રોત્સાહિત કરવા
- કોળું પર કોતરણી (પમ્પકીન કાર્વિંગ્સ) કામ ઘરે કરવું
- રાત્રે મૂવી જોવું કે ડરામણી વાર્તાઓ કહેવી કે સાંભળવી
- ઘર આગળની લોન્સ શણગારવી

આપણાં સમુદાયને સુરક્ષિત રાખવામાં મદદ મેળવવા, સીટી ઓફ બ્રેમ્પટન આ વર્ષે કુટુંબોના આનંદ માટે વિશાળ શ્રેણીના મજાના, મફત આયોજનો કરવાનું છે!

### કોળાના સુશોભનની સ્પર્ધા (પમ્પકીન ડેકોરેટિંગ કન્ટેસ્ટ)

સ્પૂકી સ્પિરિટ (બિહામણી ભાવના)માં રહો અને તમારી પમ્પકીનને સુશોભિત કરવાની આવડતો ટેખાડો. એક સ્વીમ, સ્કેટ કે ક્રિટનેસ કાર્યક્રમમાં હાજર રહેવા બ્રેમ્પટન રિક્રિએશન પાસીસની 50 જોડીઓમાંથી એક જોડી જીતવા ઓક્ટોબર 16 થી 29 સુધીમાં તમે સજાવેલા પમ્પકીનનો ફોટો મોકલો! સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ છે, [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation).

### મફત રાક્ષસી કદની મેશ એક્ટિવિટી કિટ્સ

ઘરે હેલોવીન પ્રવૃત્તિ કરીને રચનાત્મક બનો! એક તૈયાર સપ્લાય કિટનો ઉપયોગ કરીને અને એક-એક કરીને પગલું ભરીને ઓનલાઈન ટ્યુટોરિયલ અનુસરીને તમારો પોતાનો મોન્સ્ટર (રાક્ષસ) બનાવો. પિકઅપ કરવા (લઈ જવા) માટેની મફત એક્ટિવિટી કિટ્સ ઓક્ટોબર 19 થી શરૂ કરીને ઉપલબ્ધ થશે. સંપૂર્ણ વિગતો અહીં ઉપલબ્ધ છે, [www.brampton.ca/recreation](http://www.brampton.ca/recreation).

### કુશળ પહેરવેશ સ્પર્ધા

આ હેલોવીનમાં, કુશળ કારીગર બનો અને શહેરનો સૌથી શાનદાર હેલોવીન પહેરવેશ બનાવો! આ શહેર 10 વર્ષ અને ઓછી ઉંમરના બાળકો માટે ટોચના ત્રણ કોસ્ચ્યુમ્સ (પહેરવેશ) માટે સહભાગી થતી દરેક વ્યક્તિ માટે એક ખાસ સ્કૉલ અને ગિફ્ટ સાથે, એવોર્ડ્સ આપશે. અમારી જજ્જસની પેનલમાં મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown), સીટી કાઉન્સિલર ડગ વિહલન્સ (Doug Whillans), રીજીયનલ કાઉન્સિલર રોવેના સેન્ટોસ (Rowena Santos), પીલ રીજીયનલ પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ નેવ શિન્ઝર (Nav Chhinzer), પીલ ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ ટ્રસ્ટી કેથી મેકડોનાલ્ડ (Kathy McDonald), અને શહેરના એક્ટિંગ (કાર્યકારી) કમ્યુનિટી સર્વિસીસ કમિશ્નર ડેરેક બોય્સ (Derek Boyce) સામેલ છે.

સોશિયલ મીડિયા પર ઓક્ટોબર 31 થી નવેમ્બર 6 સુધીમાં તમારા કોસ્ચુમનો ફોટો વહેંચીને અને સ્થાનિક બ્રેમ્પટન ટ્રીટ વેન્ડર્સ પાસેથી કેટલાક ચડિયાતા ઈનામો જીતવાની તક માટે #BramptonCraftiestCostume2020 નો ઉપયોગ કરો!

વિજેતાઓનો સીધો સંપર્ક કરવામાં આવશે અને શહેરની સોશિયલ મીડિયા ચેનલ્સ પર ઘોષણા કરવામાં આવશે.

### ગ્રેટ પમ્પકીન પાર્ટી અને સોશિયલ મીડિયા સ્પર્ધા

આ વર્ષે, ગ્રેટ પમ્પકીન પાર્ટી વર્યુઅલ થવાની છે. વ્યાવસાયિક કોળુ કોતરણી કલાકારો (પમ્પકીન કાર્વિંગ આર્ટિસ્ટ્સ) રિક જૉકોબસન (Rick Jacobson) અને રોય ચિશોલ્મ (Roy Chisholm) ને શિલ્પકળાના અને 3D જૉક-ઓ-લેન્ટર્ન્સ બનાવતા નિહાળો! ખાસ માહિતી અને યુક્તિઓ જાણો અને ચોક્કસપણે પમ્પકીન ડેકોરેટિંગ સ્પર્ધામાં તમારી બનાવટ દાખલ કરો.

હેલોવીનને અનુસરીને, તમારું કોસ્ચુમ છેલ્લી વાર પહેરો અને તમારા પમ્પકીન્સને ખાતર આપતો એક ફોટો લો. તમારા પમ્પકીન્સને ખાતર આપવાની રીત [અહીં](#) જાણો. તમારો ફોટો સોશિયલ મીડિયા પર નવેમ્બર 1 થી 6 સુધીમાં વહેંચો અને કેટલાક ચડિયાતા ઈનામો જીતવાની તક માટે #BramptonHalloween2020 નો ઉપયોગ કરો!

વિતેલા વર્ષોમાં, સીટીએ રહેવાસીઓને ગ્રેટ પમ્પકીન પાર્ટીમાં ભગડી ન જાય તેવા ખાદ્યપદાર્થો લાવવા કહ્યું છે. આ વર્ષે અગાઉ ક્યારેય કરતા વધારે, સ્થાનિક ફૂડ બેંક્સને સહાયતાની જરૂર છે. કૃપા કરી તમે દાન આપી શકો તેવી કોઈપણ રકમ સ્થાનિક ફૂડ બેંક્સને આપવાનું વિચારશો.

### અવતરણો (ક્વોટ્સ):

“પ્રોવિન્સના ટ્રિક ઓર ટ્રીટની સામે સલાહ આપતા નિર્ણયને ધ્યાનમાં રાખીને, સીટી આ વર્ષે બ્રેમ્પટનમાં હેલોવીનની ઉજવણી કરવા સંખ્યાબંધ પગલાઓ ભરી રહ્યું છે અને હું કુશળ પહેરવેશ (કોસ્ચુમ) સ્પર્ધા, કોળુ સજાવટ અને ગ્રેટ પમ્પકીન પાર્ટી સહિતની અમે યોજેલી મોજમજની પ્રવૃત્તિઓનો આનંદ માણવા દરેક વ્યક્તિને પ્રોત્સાહિત કરું છું.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“આ હેલોવીનમાં, આપણાં સમુદાયનું આરોગ્ય અને સુખાકારીને ટોચમાં ધ્યાનમાં લેવા અને તમારા પ્રિયજનો સાથે ઘરે સુરક્ષિતપણે ઉજવણી કરવા ચોક્કસ રહો. અમે તમારા કુટુંબીજનો સાથે આનંદ માણવા ઘણી રોમાંચક, સુરક્ષિત પ્રવૃત્તિઓ રાખી છે અને કેટલાક ચડિયાતા ઈનામો જીતવાની તક માટે અમારી સ્પર્ધાઓમાં સહભાગી થવા ચોક્કસ રહેશો!”

- હરકિરત સિંઘ (Harkirat Singh), સીટી કાઉન્સિલર, વોર્ડ્સ 9 અને 10; પ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“આપણે આ વર્ષે હેલોવીનની ઉજવણી અંતર જાળવીને કરીશું, પણ તેનો અર્થ એ થતો નથી કે આપણે કોઈપણ રીતે ઓછાં જોડાયેલા રહીએ છીએ. એક સ્પૂકી કોસ્ચુમ (ડરાવતો પહેરવેશ) પહેરો, અમારી ઓનલાઇન પ્રવૃત્તિઓ તપાસો, અને સોશિયલ મીડિયા પર 10 વર્ષ અને ઓછી ઉંમરના બાળકો માટે #BramptonCraftiestCostume2020, અને તમે તમારા કોળાને ખાતર આપો ત્યારે #BramptonHalloween2020 પર કોસ્ચુમ પહેરેલા ફોટા વહેંચવાનું ભૂલશો નહીં!”

- રોવેના સેન્ટોસ (Rowena Santos), પ્રાદેશિક કાઉન્સિલર વોર્ડ્સ 1 અને 5; ઉપપ્રમુખ, કોર્પોરેટ સર્વિસીસ, સીટી ઓફ બ્રેમ્પટન

“આ વર્ષે સમગ્ર બ્રેમ્પટનમાં હેલોવીનની ઉજવણી કરતી વખતે આરોગ્ય અને સુરક્ષા અમારી અગ્રતા રહે છે. ઘરે રહીને ઉજવણી કરવા પીલ પબ્લિક હેલ્થના સુરક્ષા ઉપાયો વડે ઉજવણી કરવા ચોક્કસ રહેશો. એક પમ્પકીન સજાવો, મોન્સ્ટર મેશ એક્ટિવિટી કિટ મેળવો, અને આ દિવસનો આનંદ માણશો!”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક :**

મોનિકા દુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)